

ન્યૂ જર્સી મતદાર નોંધણી માટેની અરજી

કૃપા કરીને શાહીમાં સ્પષ્ટ રીતે છાપો. વૈકલ્પિક ચિફ્રિત ન થાય ત્યાં સુધી બધી માહિતી આવશ્યક છે.

1 લાતુ પાઠે તે બચ્ચ ાનલી તીચણી ાનામ કેરશાર ારાર્થિય પક્ષ જોડાણ	ू र्या उरान शाहामा स्पष्ट रात छापा. पंजाल्पंड ायावत न याच त्या सुवा जवा माहिता जापश्येङ छ.										
(જો ના, તો આ ફોર્મ લસે નહી) 4 પ્રતિમ નામ પધ્ય નામ અહવા ઇનીશ્રવ પુત્રવ ઘડ છે. જે, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,	1									OR OFFICIAL USE ONLY	
5 જન્મ તારીખ (મમ / કહિ / વવવવ) / 6 જતી (વૈકલ્પીક) □સી □પુરુષ □પુરુષ □ભીદ વિકલ્પીક) □સી □પુરુષ □ભીદ વિકલ્પીક □સી વિકલ્પીક □સી □પુરુષ □ભીદ વિકલ્પીક □સી □પુરુષ □ભીદ વિકલ્પીક □સી □પુરુષ □ભીદ ચાઇડી નથી તેના સે મારે ક્ષેત્ર કે મારે કહે કે મારે કહે કે મારે કહે કહે કહે કે મારે કહે કહે કે મારે કહે કહે કહે કહે કહે કહે કહે કહે કહે કહ	2									erk	
7 ન્યું વર્સી ડુલવર લાયસંત નંબર સવાવા પ્રેમ વીસે નીન-ડુલવર આઈ.ડી નંબર \ ગે તમારી મારે બેચકું કુલકરને લાયસ મારા એ પ્રેસી નીને કુલવર આઈ.ડી નંબર \ ગે તમારી મારે બેચકું કુલકરને લાયસ મારા એ પ્રેસી પ્રેમ છે. 4 મોરે પ્રકાર મારે કુલવર આઈ.ડી નંબર એ! પ્રકાર ને કુલ કુલ નંબરના છે.લા મારે મારા કુલ મારે લાઈ કુલ મારે મારે મારે કુલ મારે કુલ મારે કુલ મારે કુલ મારે કુલ મારે કુલ મારે મારે મારે કુલ મારે કુ	4						Re	egistration #			
ા કું શપથ લઇ છું અથવા પુષ્ટિ આપું છું કે મારી પાતે એન જે ડ્રાઇલરનું લાઇમસ નથી. એમ વીકી નોન્ક ડ્રાઇલર આઇ.ડી અથવા સામજિક સુરક્ષા નંબર નથી.* 8 ધરનું સરનામું (મી.સ. ઓક્સન ઉપએગ કરશો નથી.) એપાર્ટમેન્ટ મ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્ટરી રાજ્ય ઝીપ કોડ □ by mail In person 10 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું એમ તેમ કાર્યા કરશો નથી. એમ વીકી નોન્ક ડ્રાઇલરી કાઉન્ટરી રાજ્ય ઝીપ કોડ □ by mail In person 10 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું એમ કરામું એમ માટે મ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્ટરી રાજ્ય ઝીપ કોડ □ by mail In person 11 ભૂતપૂર્વ નામ જો નામ બદલતા છે તો 12 દિલસનો ફ્રેલ નંબર (વેકલ્પિક) □ by mail In person 13 શું તમે રાજકીચ પક્ષ સાથે જોડાણ જાઠેર કરવા માંગો છે? □ દ્વા. પક્ષનું નામ છે □ by ward 13 શું તમે રાજકીચ પક્ષ સાથે જોડાણ જાઠેર કરવા માંગો છે? □ દ્વા. પક્ષનું નામ છે □ by સ્વીધિ પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ bistict 13 શું તમે રાજકીચ પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ bistict 14 બધી ભવિષ્યની યુંટણીઓ માટે મેઇલન ઇન મતપત્ર મારે લિનેતી (વેકલ્પિક) □ માટે કાઉન્ટરી કરવાંકની ઓફિસમાં લિમિતમાં વિનંતી ના કર્ફ ત્યાં સુધી બધી ભવિષ્યની ચાર મારા મતપત્ર નીચેના સરનામાં પર મેઇલ કરો જો ઉપરના મેઇલિંગ સરનામાં મેઇલિંગ સરનામાં મોશી અલગ હેય. મેઇલિંગ સરનામાં મારે મેઇલ કર્ફ જો ઉપરના મેઇલિંગ સરનામાં મારે કાઇ કર્ફ જો હાયક અને કાઉન્ટર્સમાં રહીશ ચૂંધાની કાઇ અપ્યા મારે કાઇ કર્ફ જો હાયક અહ્યા હાયક અહ્યા કાઇક સ્ટેરના સુધી મારે કાઇક જો સાથે મારે કાઇક જો હાયક હાયક અહ્યા હાયક પ્રયાચ પ્રયાચ ફાંધા મારે કાઇક જો સાથે મારે કાઇક જો હાયક હાયક હાયક પ્રયાચ પ્રયાચ પ્રયાચ ફાંધાર્થ કરે સ્ટેરના મારે કાઇક હેયા હતા મારે કરે કરે કરી હતા સુધી કરા હતા મારે કરિયા મારે કરિયા મારે કરે કરે કરી હતા સુધી કરી સુધી કરા હતા સાથે કરી કરી કરી મારે કરી કરી કરી કરી કરી મારે કરી	5	૪૦મ તારીખ (મમ / દિદિ / વવવવ) / / 6 જાતી (વૈકલ્પીક) □સ્રી □ પુરુષ								fice Time Stamp	
8 ધરના મં ત્યાં આ આક્રમનો ઉપયોગ કરશો નહીં) એપાર્ટમેન્દ્ર ચ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્દર્શ રાજ્ય ઝીપ કોડ □ by mail □ in person 10 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું 'એપાર્ટમેન્દ્ર' ચ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્દર્શ રાજ્ય ઝીપ કોડ □ by mail □ in person 11 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું એપાર્ટમેન્દ્ર ચ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્દર્શ રાજ્ય ઝીપ કોડ □ by mail □ in person 11 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું એપાર્ટમેન્દ્ર ચ્યુનિસિપાલિટી (મહેર/નગર) કાઉન્દર્શ રાજ્ય ઝીપ કોડ □ by mail □ in person 11 મત માટે નોંધાચેલ છેલ્લું સરનામું અંગ માંધાચેલ કરતો. □ કાઉન્દર્શ કાઉન્દર કાઉન કાઉન્દર્શ કાઉન્દર કાઉન કાઉન્દર્શ કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન્દર કાઉન કાઉન્દર કાઉન કાઉન કાઉન કાઉન કાઉન્દર કાઉન્દર કાઉન્દર કાઉન્દર કાઉન	7	ન્યૂ જર્સી ડ્રાઇવર લાયસંસ નંબર અથવા એમ.વી.સી નોન-ડ્રાઇવર આઈ.ડી નંબર જો તમારી પાસે એન.જે ડ્રાઇવરનું લાઇસન્સ અથવા એમ.વી.સી નોન-ડ્રાઇવર આઈ.ડી નથી, તો તમારા સામાજિક સુરક્ષા નંબરના છેલ્લા 4 અંકો પ્રદાન કરો									
9 મેઇલિંગ સરનામું (જે ઘરના સરનામાંથી અલગ હોય તો) એપાર્કમેન્ટ ધ્યુનિસિપાલિટી (જાહેર/નગર) કાઉન્ટી રાજ્ય ઝીપ કોડ □by mail □in person 10 મત માટે નોંધાયેલ છેલ્લું સરનામું (પાર્ચમ તોશ્યુલ્લ કરવામું) એપાર્કમેન્ટ મ્યુનિસિપાલિટી (જાહેર/નગર) કાઉન્ટી રાજ્ય ઝીપ કોડ Muni Code # 11 ભૂતપૂર્વ નામ જો નામ બદલતા હો તો □2 દિવસનો ફોન નંબર (વૈકલ્પિક) ૄ ૄ મેઇલ સરનામું (વૈકલ્પિક) ૄ ૄ માંધાન લિચ્ચની ચૂંટણીઓ માટે મેઇલ ઇન મતપત્ર માટે લિનંતી (વૈકલ્પિક) ૄ ૄ ફાઇન્ટી ઇલાન્ટી કલાર્કની ઓફિસમાં લિખતામાં વિનંતી ન કફે ત્યાં સુધી બધી ભવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે લિનંતી (વૈકલ્પિક) ૄ ૄ ફાઇન્ટી ઇલાન્ટી કલાર્કની ઓફિસમાં લિખતામાં વિનંતી ન કફે ત્યાં સુધી બધી ભવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મત પત્ર પ્રાપ્ત કરવા માંગુ છું. ૄ ફાઇન્ટર કલાર્કની એપાર્ટમેન્ટ મ્યુનિસિપાલિટી (જાહેર/નગર) રાજ્ય ઝીપ કોડ હિલાના માટે લિનંતી (વૈકલ્પિક) ૄ મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો ચામ મેઇલ કરી જો ઉપરના મેઇલિંગ સરનામાંથી અલગ હોય. મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો ચામ મેઇલ કરી જો ઉપરના મેઇલિંગ સરનામાંથી અલગ હોય. • ફું આગામી ચૂંટણીના ઓછામાં એલા 30 દિવસ પહેલા પ્રત્યાન અલગ હાલનાઇને કહેવામાં રહીય પરના સરનામાં પર રફું છું કહે લે દેવના સુધા સાથે હોય		🗖 "ઠું શપથ લઉં છું અથવા પુષ્ટિ આપું છું કે મારી પાસે એન.જે ડ્રાઇવરનું લાઇસન્સ નથી, એમ.વી.સી નોન-ડ્રાઇવર આઈ.ડી અથવા સામાજિક સુરક્ષા નંબર નથી."									
10 મત માટે નોંધાયેલ છેલ્લું સરનામું (પી.ચે. લોકમનો ઉપયોગ કરશો નહી) 11 ભૂતપૂર્વ નામ જો નામ બદલતા છે તો 12 હિવસનો ગ્રેન નંબર (વૈકલ્પિક) 13 શું તમે રાજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરવા માંગો છો? િક્ષ, પક્ષનું નામ છે (વૈકલ્પિક) 14 ભાવી ભાવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) 15 શું તમે રાજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરવા માંગો છો? િક્ષ, પક્ષનું નામ છે (વૈકલ્પિક) 14 ભાવી ભાવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) 15 શું કાઉન્ટી કલાર્કની ઓફિસમાં લેખિતમાં વિનંતી ન કરૂં ત્યાં સુધી બધી ભાવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) 18 મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો 19 કું યાયા લાઉ છું અથવા ખાતરી આપું છું. 19 ફું આગામી ચૂંટણીના ઓછામાં ઓછા 30 દિવસ 19 મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો 19 કું યાયા લાઉ છું અથવા ખાતરી આપું છું. 19 ફું આગામી ચૂંટણીના ઓછામાં ઓછા 30 દિવસ 19 ફું સમજું છું કે કોઈપણ ખોટી કે બનાવટી 19 ફું મામ પ્રયાસ સરનામાં પર રહું છું 2 ફું આગામી ચૂંટણીના ઓછામાં ઓછા 30 દિવસ 19 ફું સાચા લાઉ છું અથવા ખાતરી આપું છું. 2 ફું આગામી ચૂંટણીના એહામાં સોહન સરનામાં શિલ્ત 2 ફું આગામી ચૂંટણીના એહામાં એકલ કાઈ સ્ત્રામાં સુધિતી કર, અથવા બનાવટી 2 ફું સાચા લાઉ છું અથવા ખાતરી આપું છું. 3 ફું આગામાં અહા 17 વર્ષનો છું, અને મમજી શું છું કે ફું અઢા શાસ પહેલા રાજ હોઈ સરના સુધિની કર, અથવા બના ચૂં છું શું શું કરવાના પરિણા મેકલનો રહ્યા હોઈ સરના સુધિની કર, અથવા બના ચૂં છું શું શું છું છે. 3 માં માં પ્યાયા માં આવે સુધિની કર, અથવા માં અને સરનામું માં અને સરનામું મુહિત કરો. 4 સરનામું માં માં અને મારે મહત્વપૂર્ણ સુચનાઓ 4 સરનામું માં માં માં અને મારે મહત્વપૂર્ણ સુચનાઓ 5 સાં માં આપ્ર પાડ સામાં સાં સુધિની કરત પાડ વર્ષનો નાક્ષ પાડના કરવાનું રાળવા માટે વર્તાના સુધિના માં સાં માં સુધિની કરત પાડનામાં સાચેનો રાત્ર માં સાચેના સાચે છે. કો તે સચા પુદાન કરીને બાળ ગે માન્ય સુધિના સુધાન કરીનો બાળ માં સુધાન કરીનો પાડ માં સાચે જોડાણ બદલ રહીને જે આવા નંબરીનો ગે મારે સુધીના માં માં સાચે મારે સુધીના કરી સાચે સાચે સાચા કરો એ તે સચા પુદાન કરીને બાળ માં	8	ધરનું સરનામું (પી.ઓ. બોક્સનો ઉપયોગ કરશો નહીં) એપ	ાર્ટમેન્ટ	મ્યુનિસિપાલિટી (શહે	डे२/नगर) ह	કાઉન્ટી	રાજ્ય	ઝીપ કોડ			
11 ભૂતપૂર્વ નામ જો નામ બદલતા છે તો 12 હિવસનો ગ્રેન નંબર (વૈકલ્પિક) ઇ-મેઇલ સરનામું (વૈકલ્પિક) □ ાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. 14 બધી ભવિષ્યની યુંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) □ ના, કું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. 14 બધી ભવિષ્યની યુંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) □ મેઇલિંગ સરનામું ઉપરથી આવા મેટે માંગ પુંચ કરે જો ઉપરના મેઇલિંગ સરનામુંથી અલગ હોય તો ચેપાર્ટમેન્ટ મ્યૂકનિસિપાલિટી (જ્રાઇટ-ઇન્ઝન) રાજ્ય ઝીપ કોડ પોલણા કહું કહું કહું કહું કહું કહું કહું કહું	9	-					રાજ્ય	ઝીપ કોડ		•	
13 શું તમે રાજકીચ પક્ષ સાથે જોડાણ જાહેર કરવા માંગો છો? □ હા, પક્ષનું નામ છે		(પી.ઓ. બોક્સનો ઉપયોગ કરશો નહીં)	ાર્ટમેન્ટ	મ્યુનિસિપાલિટી (શહે	हेर/नगर) ह	કાઉન્ટી	રાજ્ય	ઝીપ કોડ			
13 શું તમે રાજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરવા માંગો છે? □દ્યા. પક્ષનું નામ છે □તા. દું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ાંકiriat (વૈકલ્પિક) □ાના. દું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ંદાisiat (વૈકલ્પિક) □ાના. દું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ંદાisiat (વૈકલ્પિક) □ાના. દું કોઈ સાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ાંદાisiat (વૈકલ્પિક) □ાના. દું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. □ાંદાisiat (વૈકલ્પિક) □ાના. દું કોઈના. વિકલ્પિકની ઓફિસમાં લેખિતમાં વિનંતી નંદા તેતી (વૈકલ્પિક) □ાના. સું કોઈના. વિકલ્પિકની ઓફિસમાં લેખિતમાં વિનંતી નંદા તેતી (વિકલ્પિકની ચુંદા સુધી આધી ભારે મારે મતપત્ર મારે મતપત્ર મારે છે. ચામાં મારે મંઇલ કરો જો ઉપરના મેઇલિંગ સરનામાંથી અલગ હોય. મેઇલને સરનામાંથી અલગ હોય. મેઇલિંગ સરનામાં પર રહું છું કે હું આક્ષમાં મહેલા કરાય હાય હાય હાય હાય હાય હાય હાય હાય હાય હ	11	૧ ભૂતપૂર્વ નામ જો નામ બદલતા હો તો 12 દિવસનો ક્રોન નંબર (વૈકલ્પિક)							Pa	arty	
ા ના, હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ઇચ્છા નથી કરતો. 14 બધી ભવિષ્યની યુંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) □ હું કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં લેખિતમાં વિનંતી ન કરું ત્યાં સુધી બધી ભવિષ્યની યુંટણીઓ માટે મેઇલ-ઇન મત પત્ર પ્રાપ્ત કરવા માંગુ છું. □ મારૂ મતપત્ર નીચેના સરનામાં પર મેઇલ કરો જો ઉપરના મેઇલિંગ સરનામાંથી અલગ હોય. મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો ચેપાર્ટમેન્ટ મ્યુનિસિપાલિટી (શહેર/નગર) રાજ્ય ઝીપ કોડ પહેલા સરનામાં વર્લફ છું અગ્રતા માંગુ છું. ■ હું યુ.એસ. નાગરિક છું • હું આગામી યુંટણીના ઓછામાં એછા 30 દિવસ પહેલા રાજ્ય અને કાઉન્ટીમાં રહીશ પહેલા રાજ્ય અને કાઉન્ટીમાં રહીશ • હું આચાયા અન્ય રાજ્ય અવે કાઉન્ટીમાં રહીશ નાંપણી મને \$ 15,000 સુધીનો દંડ, 5 વર્ષ સુધીનો કેદ પહેંચું ત્યાં સુધી મત આપી શકીશ નહીં. કરવાને પરિણામે કેદની સજા લોગવી રહ્યો નથી. 19:34-1ના અનુસંધાનમાં થઈ શકે છે. નોંધણી કરાવનારની સહી: નીચેની લીટીઓ પર સહી અથવા ચિક્ર અને તારીખ વારીખ મામ / હિદ્દ / વવવવ) / / સરનામું મુદ્દિત કરો. નામ તારીખ (મમ / હિદ્દ / વવવવ) / / સરનામું મુદ્દિત કરો. નામ તારીખ પાત્ર હોઈ આઈ. કે અથવા તેમ પુદાન કરેલી માહિતી ચકાસી શકાતી નથી.તો તમને મતદાનના થયો ભોળો પણ ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માન્ય કોટો આઈ. કે અવે તોના પત્ર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથીને થળો ભોળપ લ્યાન્ક જે આવા તોને પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથીને થળો ભોળપ લ્યાન કરેલામાં આવશે. નામ કરવાનું જે આવા તેમ પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથીને થળો ભોળપ લ્યાન કરવાનું કહેવામાં આવશે. નીધ: અઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજની દ્વારા બહાર પાડવામાં આવશે નહીં કોઈપણ વ્યક્તિ કહેવામાં આવશે. કરેશ કરી કોઈપણ વ્યક્તિ કરેશ પાત્ર રહેશે. 8) જાતે પર વિકેણા છો, તો તમે સંપ કરે પોર્ક્ટન થતો માત્ર મોગો છો, તો તો માત્ર મોગો હોય માત્ર તમારો માત્ર માત્ર મોગા છો, તો પાત્ર મારેશ હો છો. જો તમો મેતા સારો મારા છો. શે પાત્ર કરેશ છો. કરેશ છો. એ સાય મારો મોગો છો, તો પાર્કા કરેશ છે. સક્કાન 13 પાર્લે કરવું એ પાર્કા કરે હો છો. એ સાય મારે છો. સર લા મારો છો. શરે છો મારે મારે મારો મારે મોગા છો. શરે છો મારે મારે મારે મોગો છો. લા મારો છો. સર લા મારો છો. લા કરે છે. સક્કાન 13 પાર્લે કરવે મે વર્લા મારા કરે કે દિવસ પહેલા મારે કરે મારે કરે હો છો. સર લા મારે કરે માત્ર કરે છો. સર લા મા		ઇ-મેઇલ સરનામું <i>(વૈકલ્પિક)</i>								ard	
14 બધી ભવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર માટે વિનંતી (વૈકલ્પિક) □ ફં કાઉન્ટી કલાર્કની ઓફિસમાં લેખિતમાં વિનંતી ન કરૂં ત્યાં સુધી બધી ભવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મત પત્ર પ્રાપ્ત કરવા માંગુ છું. □ મારુ મતપત્ર નીચેના સરનામાં પર મેઇલ કરો જો ઉપરના મેઇલિંગ સરનામાંથી અલગ હોય. મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો □ પોતાને આપતાર્થી અલગ હોય તો □ પોતાને અને મારે ત્યાં પાર રહે છું ■ ફૂં ચુ.એસ નાગરિક છું ■ ફૂં ચોશના ચારના સરનામાં પર રફે છું ■ ફૂં આશના ચોશન પર સફી અથવા વિતાન પર સફી અથવા વિતાન પર તારીખ ખાત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છેઃ જો તમે સેક્શન 7 દ્વાર જરૂરી કોઇ માહિતી પરના માં આ અને વાત્તાના સરનામાં ચારે આપતા માટે નાંધણી અને સરનામું મુદ્રિત કરો. નાંધણી કરાવનાર કે જેઓ આ ઢોમે મેઇલ કારા રજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છેઃ જો તમે સેક્શન 7 દ્વાર જરૂરી કોઇ માહિતી પાતાના અને માટે માટે તામે આવા માટે વાતાના અને માટે તાનું અથવા માટે ચારે ચારે ચાર માટે ચાર પાર કરો છે તે સ્થાન પાર કરી છે તો માટે અથવા તેના પર તમાર નામ અને વર્તમાન સરનામાં આવશે. નોંધઃ આઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઇપણ સરકારી એજનની દ્વારા બહાર પાડવામાં આવશે નહી. કોઇપણ વ્યામાં લીધા વિના અસંબંધિત હોવાનું જારેર કરી શકે છે. જો તમે અગાઉશી જોડોલા મતદાતા છે જ રાજીય પક્ષ શ્રોય આ ફોઈ અથવા માગો છો. તો પાચીમ કરે છી મારે મારે મારે મારો છો કરે થું ચામાં 13 છો કરફ એ 13 મું કરફ એ અગાઉશી જોડોલા મતદાતા છે જ રહીયા પાયા ફાય ફોઈ માતે મારે મારે મારે મારે કરે થી મારે કરફો માતે આ ફાયા માગો છો. તો પાચી માત્ર મારે માત્ર માત્ર માત્ર માત્ર માત્ય										strict	
ું ફું કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં લેખિતમાં વિનંતી ન કરું ત્યાં સુધી બધી લિવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મત પત્ર પ્રાપ્ત કરવા માંગુ છું. □ મારુ મતપત્ર નીચેના સરનામાં પર મેઇલ કરો જો ઉપરના મેઇલિંગ સરનામાંશી અલગ હોય. મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો ચેપાર્દમેન્ટ ચ્યુંનિસિપાલિટી (શહેર/નગર) રાજ્ય ઝીપ કોડ ચોષણા - ફું શપથ લઉં છું અથવા ખાતરી આપું છું: ● ફું આગામી ચૂંટણીના ઓછામાં ઓછા 30 દિવસ પહેલા ગારીક છું ● ફું આગામી ચૂંટણીના ઓછામાં એછા 30 દિવસ નું ફું શપથ લઉં છું અથવા ખાતરી આપું છું: ● ફું આગામી ચૂંટણીના ઓછામાં એછા 30 દિવસ નું ફું શપણ પ્રાપ્ત 1 વર્ષ નું ફું શપણ પ્રાપ્ત 1 વર્ષ નું ફું શપણ પાર્ટી કે બનાવટી હે ફું યુએસ. નાગરિક છું • ફું આગામી ચૂંટણીના એછામાં એછા 30 દિવસ નું ફું સમજું છું કે કોઈપણ ખોટી કે બનાવટી હે ફું યુએસ. નાગરિક હું મું ફું ફું ફું કું કાયદા ફું ફું ફું કું કાયદા ફું કહે કાયદા ફું ફું ફું કું કું કાયદા ફું કું ફું કું કાયદા ફું ફું ફું કરવાના પર તારી મું મું કું ફું કું કાયદા ફું કું ફું કરવાને પરિણામે કેદની સજા ભોગવી રહ્યો નું આ માર્ચા અનુ માર્ચા ચૂં નું અરજદાર આ ફ્રોમ ભરવામાં અસમર્થ છે, તો આ ફ્રોમ નું કું ફું ફું ફું ફું ફું ફું ફું ફું ફું ફ											
ઘોષણા - ઠું શપથ લઉં છું અથવા ખાતરી આપું છું: ● ઠૂં યુ.એસ. નાગરિક છું ● ઠું લે પરના ધરનામાં પર રઠું છું ● ઠું લે પરના ધરનામાં પર રઠું છું • ઠું લે પરના ધરનામાં પર રઠું છું • ઠું લે પરના ધરનામાં પર રઠું છું • ઠું આક્ષામાં ઓછા 17 વર્ષનો છું. અને સમજી શકું છું કે ઠૂં કહાદ ઠેળા કોરપણ આરોપી ગુનાથી દોષિત નુનાથી દોષિત નુનાથી હોષિત કરાવો પરિણામે કેદની સજા ભોગવી રહ્યો નથી. • ઢાં લાં લાં કરાવો હોં હોં હોં હોં હોં હોં હોં હોં હોં હો	🛘 🖟 કું કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં લેખિતમાં વિનંતી ન કરું ત્યાં સુધી બધી ભવિષ્યની ચૂંટણીઓ માટે મેઇલ-ઇન મત પત્ર પ્રાપ્ત કરવા માંગુ છું.										
• હું યુ.એસ. નાગરિક છું પૈહેલાં રાજ્ય અને કાઉન્ટીમાં રહીશ નાં હિલા મને કું 15,000 સુધીનો દંડ, 5 વર્ષ કું ઉપરના ઘરના સરનામાં પર રહું છું કું આછામાં એછા 17 વર્ષનો છું, અને સમજી શકું છું કે હું આછામાં એછા 17 વર્ષનો છું, અને સમજી શકું છું કે હું 18 વર્ષની ઉંમરે પહોંચું ત્યાં સુધી મત આપી શકીશ નહીં. 6રવાને પરિણામે કેદની સજા ભોગવી રહ્યો નથી. 19:34-1ના અનુસંધાનમાં થઈ શકે છે. નોંધણી કરાવનારની સહી: નીચેની લીટીઓ પર સહી અથવા ચિહ્ન અને તારીખ તારીખ સરનારા વ્યક્તિનું નામ અને સરનામું મુદ્રિત કરો. નામ તારીખ / / / (મમ / હિલ્ / વવવવ) / / નારીખ / (સમ / હિલ્ / વવવવ) / / નારીખ / (સમ / હિલ્ / વવવવ) / / સરનામું સ્ટિક્સન્સ 7, 8, 13 અને 14 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ રાહ્યું કરો રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવનાર કે જેઓ આ ક્ષેમ મેઇલ દ્વારા રજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છેઃ જો તમે સેક્શન 7 દ્વારા જરૂરી કોઈ માહિતી પૂરી પાડશો નહીં,અથવા તેના પર તમારા નામ અને વર્તમાન અને મતદાનના સ્થળે ઓળખ પ્રદાન ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માત્યા કોટો આઈ.ડી અથવા તેના પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથેની દસ્તાવેજની નકલ પ્રદાન કરવાનું કહેવામાં આવશે. નોંધા આઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ જે આવા નંબરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તે ગુનાહિત દંડને પાત્ર રહેશે. 8) જો તમે ઘર વહેણા છે. તો તમે સંપર્ક પોઇન્ટ અથવા તમે તમારો મોટાભાગનો સમય જ્યાં પસાર કરો છે તે સ્થાન પ્રદાન કરીને વિભાગ સેક્શન 8 પૂર્શ કરી શહે 13) તમે રજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરી શકો છે અથવા તમે આવાઉના કોઈપણ પક્ષ સાથે જોડાણને ધ્યાનમાં લીધા વિના અસંબંધિત હોવાનું જાહેર કરી શકો છે. જો તમે અગાઉથી જોડાચેલા મતદાતા છે જે રાજકીય પક્ષ સાથે જોડાણ બાલવા માંગો છે. સેકાના 13 પૂર્ણ કરવું એ		મેઇલિંગ સરનામું ઉપરથી અલગ હોય તો			એપાર્ટમેન્ટ	મ્યુનિસિપાઉ	ોટી (શફે	ર/નગર)	રાજ્ય	ઝીપ કોડ	
સેક્સન્સ 7, 8, 13 અને 14 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ 7) નોંધણી કરાવનાર કે જેઓ આ ફોર્મ મેઇલ દ્વારા રજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છેઃ જો તમે સેક્શન 7 દ્વારા જરૂરી કોઈ માહિતી પૂરી પાડશો નહીં,અથવા તમે પ્રદાન કરેલી માહિતી ચકાસી શકાતી નથી,તો તમને મતદાનના સ્થળે ઓળખ પ્રદાન ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માન્ય ફોટો આઈ.ડી અથવા તેના પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથેનો દસ્તાવેજની નકલ પ્રદાન કરવાનું કહેવામાં આવશે. નોંધઃ અઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ જે આવા નંબરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તે ગુનાહિત દંડને પાત્ર રહેશે. 8) જો તમે ઘર વિહેણા છો, તો તમે સંપર્ક પોઇન્ટ અથવા તમે તમારો મોટાભાગનો સમય જ્યાં પસાર કરો છો તે સ્થાન પ્રદાન કરીને વિભાગ સેક્શન 8 પૂર્ણ કરી શકો છો. તો મે રાજકીય પક્ષ સાથે જોડાણને ધ્યાનમાં લીધા વિના અસંબંધિત હોવાનું જાહેર કરી શકો છો. જો તમે અગાઉથી જોડાયેલા મતદાતા છો જે રાજકીય પક્ષ સાથે જોડાણ બદલવા માંગો છો અથવા અસંબંધિત થવા માગો છો, તો પ્રાથમિક યુંટણીમાં મત આપવાના હેતું માટે તમારે પ્રાથમિક યુંટણીના 55 દિવસ પહેલા આ ફોર્મ ભરવું આવશ્યક છે. સેક્શન 13 પૂર્ણ કરવું એ	• કું ચુ.એસ. નાગરિક છું પૈકેલાં રાજ્ય અને કાઉન્ટીમાં રહીશ નોંધણી મને \$ 15,000 સુધીનો દંડ, 5 વર્ષ • કું ઉપરના ધરના સરનામાં પર રહું છું • કું આ અથવા અન્ય રાજ્ય અથવા યુનાઇટેડ સ્ટેટ્સના • કું ઓછામાં ઓછા 17 વર્ષનો છું, અને સમજી શકું છું કે કું કાયદા હેઠળ કોઈપણ આરોપી ગુનાથી દોષિત										
# તારીખ / / સરનામું સિક્સન્સ 7, 8, 13 અને 14 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ 7) નોંધણી કરાવનાર કે જેઓ આ ક્ષેમે મેઇલ દ્વારા રજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છે: જો તમે સેક્શન 7 દ્વારા જરૂરી કોઈ માહિતી પૂરી પાડશો નહીં,અથવા તમે પ્રદાન કરેલી માહિતી યકાસી શકાતી નથી,તો તમને મતદાનના સ્થળે ઓળખ પ્રદાન ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માન્ય કોટો આઈ.ડી અથવા તેના પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથેનો દસ્તાવેજની નકલ પ્રદાન કરવાનું કહેવામાં આવશે. નોંધ: આઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ જે આવા નંબરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તે ગુનાહિત દંડને પાત્ર રહેશે. 8) જો તમે ઘર વિહોણા છો, તો તમે સંપર્ક પોઇન્ટ અથવા તમે તમારો મોટાભાગનો સમય જ્યાં પસાર કરો છો તે સ્થાન પ્રદાન કરીને વિભાગ સેક્શન 8 પૂર્ણ કરી શકો છો. જો તમે સરાથે જોડાણ જાહેર કરી શકો છો અથવા તમે અગાઉના કોઈપણ પક્ષ સાથે જોડાણને ધ્યાનમાં લીધા વિના અસંબંધિત હોવાનું જાહેર કરી શકો છો. જો તમે અગાઉથી જોડાયેલા મતદાતા છો જે રાજકીય પક્ષ જોડાણ બદલવા માંગો છો અથવા અસંબંધિત થવા માગો છો, તો પ્રાથમિક યુંટણીમાં મત આપવાના હેતું માટે તમારે પ્રાથમિક યુંટણીના 55 દિવસ પહેલા આ ફોર્મ ભરવું આવશ્યક છે. સેક્શન 13 પૂર્ણ કરવું એ	ને	ંધણી કરાવનારની સહીઃ નીચેની લીટીઓ પર સહી અથ	ં અને તારીખ	ભરનારા	ભરનારા વ્યક્તિનું નામ અને સરનામું મુદ્રિત કરો.						
સેક્સન્સ 7, 8, 13 અને 14 માટે મહત્વપૂર્ણ સૂચનાઓ 7) નોંધણી કરાવનાર કે જેઓ આ ક્ષેમે મેઇલ દ્વારા રજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છેઃ જો તમે સેક્શન 7 દ્વારા જરૂરી કોઈ માહિતી પૂરી પાડશો નહીં,અથવા તમે પ્રદાન કરેલી માહિતી ચકાસી શકાતી નથી,તો તમને મતદાનના સ્થળે ઓળખ પ્રદાન ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માન્ય ફોટો આઈ.ડી અથવા તેના પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથેનો દસ્તાવેજની નકલ પ્રદાન કરવાનું કહેવામાં આવશે. નોંધઃ આઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ જે આવા નંબરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તે ગુનાહિત દંડને પાત્ર રહેશે. 8) જો તમે ઘર વિહોણા છો, તો તમે સંપર્ક પોઇન્ટ અથવા તમે તમારો મોટાભાગનો સમય જ્યાં પસાર કરો છો તે સ્થાન પ્રદાન કરીને વિભાગ સેક્શન 8 પૂર્ણ કરી શકો છો. તમે રાજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરી શકો છો અથવા તમે અગાઉના કોઈપણ પક્ષ સાથે જોડાણને ધ્યાનમાં લીધા વિના અસંબંધિત હોવાનું જાહેર કરી શકો છો. જો તમે અગાઉથી જોડાયેલા મતદાતા છો જે રાજકીય પક્ષ જોડાણ બદલવા માંગો છો અથવા અસંબંધિત થવા માગો છો, તો પ્રાથમિક યુંટણીમાં મત આપવાના હેતું માટે તમારે પ્રાથમિક યુંટણીના 55 દિવસ પહેલા આ ફોર્મ ભરવું આવશ્યક છે. સેક્શન 13 પૂર્ણ કરવું એ			તારીખ (મમ / દિદિ / વવવવ) / /								
 7) નોંધણી કરાવનાર કે જેઓ આ ફોર્મ મેઇલ દ્વારા રેજૂ કરી રહ્યા છે અને પ્રથમ વખત મત આપવા માટે નોંધણી કરાવી રહ્યાં છે: જો તમે સેક્શન 7 દ્વારા જરૂરી કોઈ માહિતી પ્રી પાડશો નહીં,અથવા તમે પ્રદાન કરેલી માહિતી ચકાસી શકાતી નથી,તો તમને મતદાનના સ્થળે ઓળખ પ્રદાન ન કરવાનું ટાળવા માટે વર્તમાન અને માન્ય ફોટો આઈ.ડી અથવા તેના પર તમારા નામ અને વર્તમાન સરનામાં સાથેનો દસ્તાવેજની નકલ પ્રદાન કરવાનું કહેવામાં આવશે. નોંધ: આઈ.ડી નંબરો ગોપનીય છે અને કોઈપણ સરકારી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ જે આવા નંબરોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તે ગુનાહિત દંડને પાત્ર રહેશે. 8) જો તમે ઘર વિશેણા છો, તો તમે સંપર્ક પોઇન્ટ અથવા તમે તમારો મોટાભાગનો સમય જ્યાં પસાર કરો છો તે સ્થાન પ્રદાન કરીને વિભાગ સેક્શન 8 પૂર્ણ કરી શકો છો. 13) તમે રાજકીય પક્ષ સાથે જોડાણ જાહેર કરી શકો છો અથવા તમે અગાઉના કોઈપણ પક્ષ સાથે જોડાણને ધ્યાનમાં લીધા વિના અસંબંધિત હોવાનું જાહેર કરી શકો છો. જો તમે અગાઉથી જોડાયેલા મતદાતા છો જે રાજકીય પક્ષ જોડાણ બદલવા માંગો છો અથવા અસંબંધિત થવા માગો છો, તો પ્રાથમિક યુંટણીમાં મત આપવાના હેતું માટે તમારે પ્રાથમિક યુંટણીના 55 દિવસ પહેલા આ ફોર્મ ભરવું આવશ્યક છે. સેક્શન 13 પૂર્ણ કરવું એ 	x		તારીખ (મ	l <i> </i> મ / દિદિ / વવવવ)							
વૈકલ્પિક છે એને તમારી મતદાર નોંધણી અરજીની સ્વીકૃતિને એસર કરશે નહીં. 14) જો તમે ભવિષ્યની બધી યૃંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર મેળવવાની ઇચ્છા ધરાવતા હો, તો સેક્શન 14 માં યોગ્ય બોક્સને ચિફિત કરો. જ્યાં સુધી તમે તમારા કાઉન્ટી ક્લાર્કની ઓફિસમાં લેખિત વિનંતી નહીં કરો ત્યાં સુધી તમે ભવિષ્યની બધી યૃંટણીઓ માટે મેઇલ-ઇન મતપત્ર મેળવશો.											

ન્યુ જર્સી મતદાર નોંધણીની માહિતી

તમે મત આપવા માટે નોંધણી કરાવી શકો છો જો:

- તમે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક છો.
- તમારી ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષની છે.*
- તમે ચુંટણીના 30 દિવસ પહેલા રાજ્ય અને કાઉન્ટીના નિવાસી ફશો.
- હું આ અર્થવા અન્ય રાજ્ય અથવા યુનાઇટેડ સ્ટેટ્સના કાયદા ફેઠળ કોઈપણ આરોપી ગુનાથી દોષિત ઠરવાને પરિણામે કેદની સજા ભોગવી રહ્યો નથી.

*જો તમે ઓછામાં ઓછા 17 વર્ષના હો તો પણ તમે મત આપવા માટે નોંધણી કરાવી શકો છો પરંતુ 18 વર્ષની ઉંમરે પહોંચ્યા સુધી મત આપી શકતા નથી.

નોધણીની અંતિમ તારીખ: ચૂંટણીના 21 દિવસો પહેલા

જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમારા નોંધણી કમિશનર કમિશનર તમને જાણ કરશે.

જો તે સ્વીકારવામાં ન આવે તો, એપ્લિકેશનને કેવી રીતે પૂર્ણ કરવી અને / અથવા સુધારવી તે વિશે તમને જાણ કરવામાં આવશે.

પ્રશ્નો? Elections.NJ.gov ની મુલાકાત લો અથવા ટોલ-ફ્રી 1-877-NJVOTER (1-877-658-6837) પર કૉલ કરો

ફ્રોલ્ડ



NO POSTAGE
NECESSARY
IF MAILED
IN THE
UNITED STATES

BUSINESS REPLY MAIL

RST-CLASS MAIL

PERMIT NO. 206

TRENTON, NJ

POSTAGE WILL BE PAID BY ADDRESSEE

MIDDLESEX COUNTY COMMISSIONER OF REGISTRATION 26 KENNEDY BLVD STE B EAST BRUNSWICK NJ 08816-9831

իկակիկիկիկիկարորդիկերդուլելելիեւելրեւիի



મહત્વપૂર્ણ: 100% પર છાપો - ધટાડો નહીં. યોગ્ય મેઇલિંગની ખાતરી કરવા માટે સચિત્ર પ્રમાણ ફોલ્ડ કરો.

